

## સીટી ઓફ બ્રેમ્પટનની સુવિધાઓની તમામ રોશની પૃથ્વી ક્લાક (Earth Hour) માટે બંધ કરાશે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (26 માર્ચ 2019) - સીટી ઓફ બ્રેમ્પટન પોતાની સુવિધાઓ પર પૃથ્વી ક્લાક (Earth Hour)ના માનમાં 30 માર્ચ 2019, શનિવારના રોજ સાંજે 08:30 થી 09:30 બંધી રોશનીઓ બંધ રાખશે.

સીટીની સવલતો પર તમામ બિન-અનિવાર્ય રોશની અને ઇલેક્ટ્રોનિક્સ નિયુક્ત કરેલ ક્લાકે બ્રેમ્પટનની પર્યાવરણીય સ્થિરતા માટેની પ્રતિબદ્ધતાના પ્રતીક તરીકે બંધ કરવામાં આવશે. જાહેર સલામતી, સુરક્ષા, અથવા સેવાને અસર કરી શકે તેવી રોશની – જેમકે સીટીની સવલતો ખાતે સ્ટ્રીટલાઈટ્સ, સ્ટોપલાઈટ્સ, પાર્ક પાથવે રોશની અને પાર્કિંગ લોટની રોશનીઓ – ચાલુ રહેશે.

તમામ નાગરિકો અને વેપારોને આસ્વાન કરવામાં આવે છે કે તેઓ પૃથ્વી ક્લાક દરમિયાન પોતાની તમામ બિન-અનિવાર્ય રોશનીઓ બંધ કરીને સહભાગી થાય. કૃપા કરીને એવા પગલાં લેવા વિશે પણ વિચારશો કે કેવી રીતે આ ક્લાક ઉપરાંત આખા વર્ષ દરમિયાન કેવી રીતે તમે ઊર્જાની બચત કરી શકશો.

બ્રેમ્પટન ખાતેના પૃથ્વી ક્લાક (Earth Hour) વિશે વધુ જાણકારી મેળવવા [અહીં ક્લિક કરો](#).

### પૃષ્ઠભૂ

બ્રેમ્પટન આ વૈશ્વિક પર્યાવરણીય પહેલમાં 2008ની સાલથી સહભાગી થતું આવ્યું છે. 2018માં સીટીએ આ ક્લાક દરમિયાન 24 મુખ્ય સવલતો પર પોતાનો વીજળીનો વપરાશ 31% જેટલો ઘટાડ્યો હતો. આનો અર્થ એ થયો કે માંગનો ઘટાડો 1,662 KW જેટલો થયો, જેને સમજવા માટે એમ કહી શકાય કે 1,385 ઘરોને પૃથ્વી ક્લાક (Earth Hour) દરમિયાન ગ્રીડમાંથી દૂર કરવા સમાન છે.

સીટી ઓફ બ્રેમ્પટન ખાતે ઘણી બધી ચાલુ રહેલ પહેલો છે જેથી ઊર્જાને બચાવવા ઉપરાંત કાર્બન એમિશન ઘટાડે છે જેમાં સામેલ છે:

- 52 ઇલેક્ટ્રિક વેલિકલ ચાર્જિંગ સ્ટેશનો જે આખા શહેર ફરતે ઊભા કરાયા છે જેનાથી સ્ટાફ અને નિવાસીઓ વધુ ગ્રીન વાહનો પસંદ કરતા થાય
- સીટીની પાંચ સવલતો પર સૌર ઊર્જાની પેનલ્સ ઊભી કરવામાં આવી છે
- સીટીની છ સવલતો જિયોથર્મલ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે
- સીટીની માલિકીની સવલતો માટે ઊર્જા સંરક્ષણ અને ડિમાંડ મેનેજમેન્ટ પ્લાન કાર્યશીલ છે

પૃથ્વી ક્લાક એક વૈશ્વિક પર્યાવરણીય ચળવળ છે જેનું નેતૃત્વ WWF કરે છે. પૃથ્વી ક્લાક (Earth Hour)ની શરૂઆત 2007માં સિડનીમાં થઈ હતી અને તે આજે વિશ્વની પર્યાવરણ માટેની એક સૌથી વિશાળ ભૂમિગત ચળવળ બની ગઈ છે જે 180 દેશો અને પ્રાંતોમાં વ્યક્તિઓ, સમાજો, વેપારો અને સંસ્થાઓને આપણી ધરા કાળે કામ કરવા એક દસકા કરતા વધુ સમયથી પ્રેરણા આપતી રહી છે. આ ચળવળ વસુંધરાના

સૌથી ગંભીર પડકારો ઝીલવા માટે ઉકેલો લાવવાની દરેક વ્યક્તિની ભૂમિકા ઊભી કરે છે અને તમામ લોકો માટે એક સ્થિર ભવિષ્ય રચવા પોતાના કરોડો ટેકેદારોની સામૂહિક શક્તિને કામે લગાડે છે.

-30-

**મિડિયા સંપર્ક :**

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પ્ટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)